



Corporate Office: 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021 Tel.: 91 22 4353 0400 • E-mail: bluechiptex@gmail.com • Website: bluechiptexindustrieslimited.com

CIN: L17100DN1985PLC005561

Date: 3rd September, 2020

To,
Dept. of Corporate Services (CRD) **BSE Limited**Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Scrip Code: 506981

Dear Sir / Madam,

<u>Sub: Newspaper Advertisement – Notice convening 35th Annual General Meeting, Book Closure, Record Date and Remote E-voting Information.</u>

Pursuant to Regulation 30(6) read with read with Part A of Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published in today's i.e. 3rd September, 2020, Business Standard - English and Western Times - Gujarati, pertaining to the Notice convening 35th Annual General Meeting of the Company, Book Closure, Record Date and Remote E-Voting Information.

Further, the aforesaid information is also available on the website of the Company at www.bluechiptexindustrieslimited.com.

Kindly take the above on your record and disseminate the same for information of investors.

Thanking you,

Yours faithfully,

For Blue Chip Tex Industries Limited

Bhumit .M. Dharod Company Secretary

Membership No. A51555

Encl: as above

Sells entire solar project fleet of 306 Mw to US-based private equity firm

₹1.670 crore.

which is a stressed asset.



RATTANINDIA POWER PORTFOLIO

Amravati plant: 1,350 Mw debt restructuring concluded in December 2019

Goldman Sachs & Varde Partners took over ₹4,050 cr of the total debt via AB Asset Restructuring Company

NOTED PROJECTS:

- 70 Mw in Bhadla solar power park in Rajasthan ▶54 Mw in Mansa, Punjab
- Nashik plant: 1,350 Mw stressed asset, resolution plan under discussion
- Solar power projects: 306 Mw - sold to GIP at valuation of ₹1,670 crore
- ▶ 52 Mw in Uttar Pradesh
- ▶50 Mw in Pavgada solar power park in Karnataka
- 44 Mw in Katol, Maharashtra Pavagada in Karnataka and 70

SHREYA JAI Mw at Bhadla in Rajasthan — New Delhi, 2 September which are India's largest solar power parks.

The projects have 25 years of attanIndia group sold its entire solar power projpower-purchase agreements, of ect fleet of 306 Mw to which 95 per cent have PPAs US-based Global Infrastructure with NTPC and Solar Energy Partners (GIP), one of the largest Corporation of India, said the private equity firm in the renewgroup. Average tariff of RattanIndia solar projects is able energy and infra sector, for ₹4.50 per kilowatt hour. RattanIndia now has only

"This transaction demontwo power plants in its basket strates RattanIndia group's con-- Amaravati thermal power tinued track record of developplant (1,350 Mw) for which it ing high-quality infrastructure concluded debt restructuring in assets in energy space and December 2019, and Nashik creating value for all stake-This thermal power plant (1,350 Mw), holders. makes RattanIndia a partner of choice The group's solar assets incfor high-quality international luded ground-mounted projects investors like GE and GIP," said of 297 Mw, including 50 Mw at Anjali Rattan Nashier, chairperson, RattanIndia Solar,

'We are like Netflix for live education'

In an interview with Samreen Ahmad & Bibhu Ranian Mishra, GAURAV MUNJAL. co-founder and chief executive officer (CEO) of Unacademy, talks about how the pandemic has speeded up the process of the edu-tech firm to achieve \$1.45-billion valuation, and how the Bengaluru-based firm is trying to enter into news exam categories. Edited excerpts:

In six months, your company's valuation has grown threefold. How

did that happen? Before the Covid-19 pandemic, our valuation in February 2020 was 10 times better than what it was in February 2019. We were the first firm to build a live class subscription product and get the best teachers on board from Delhi and Kota. During the pandemic, after people realised the importance of our pro-**GAURAV MUNJAL** duct, they came on our plat-Co-founder & CEO, form and started using Unacademy. We have free

Unacademy classes and a subscription product. So, if you have a goal of craving an exam or even learning chess, we get you the best educators who teach you live. We are like Netflix for live education.

So, a lot of your growth's credit can be given to Covid?

Yes, for speeding up things. If Covid was not there, we would have achieved the same goal 6-7 months later.



What's next for unicorn Unacademy? We want to launch a K-12 subscription

for school students and want to expand in more exam categories and experiment with categories like chess. We are launching a new subscription called competitive programming under the brand CodeChef, which will help engineering students learn

from the best programmers

of the country. We would look at covering more products for preparing for more state and regional level examinations. We are not present in the judicial and law examinations. However, we will launch these two categories soon.

With K-12, you'll have more competition from players like Byju's and Vedantu.

Any comment? Our product is significantly better than

anything else out there in the market. We take pride in building the best products. After this round, we have a huge responsibility to build great education products for the country and the world.

So, what are the new products that you're planning to build?

There are several products in the R&D stage, which we will launch in the next two months. We have recently rolled out 'Graphy' that allows users to explore stories, ideas, books via video, audio, images. It is seeing an immense traction and we will scale it up further.

Any plans for inorganic expansion? Not now. We have a lot on our plate. Our 18-month goal is to become cash

flow positive. Do you want to take the product

beyond India?

We are not looking at it as of now, but ves, at some point, we may take the product abroad.

Your appetite for funds seems to have gone up. Is preparation for the next round is also underway?

We are adequately funded for the next one-and-half or two years. We are not looking for any more funds.

What kind of revenue brackets are you

million right now.

We are doing an annual run rate of \$120

LARSEN & TOUBRO

L&T will continue to build the future. Now, with even sharper focus.



Successfully completes divestment of its Electrical & Automation Business to Schneider Electric.

For growth, strong strategic calls are imperative, and the divestment of our Electrical & Automation business has been one such. It has also been a win-win for all concerned. While it has given the E&A business a better fit and opened vistas for new growth, it has given us the opportunity to unlock value for future growth, to consolidate, and sharpen our focus on our core areas of expertise: EPC Infrastructure &

Projects, Manufacturing & Defence, and Services. For over eight decades, we have been making the things that make India proud. We will continue to do so and, in the process, keep building the future!

We thank our partners Shardul Amarchand Mangaldas Legal Advisors, Ernst & Young LLP and Arpwood Capital who acted as our advisors for this transaction.

Schneider Electric India Pvt. Ltd. will be using the 'L&T Electrical and Automation' brand name for a specific transition period

Registered Office: L&T House, N. M. Marg, Ballard Estate, Mumbai - 400 001. INDIA. | CIN: L99999MH1946PLC004768

in /Larsen & Toubro www.Larsentoubro.com

/LarsenToubroGroup

/LnTCampusEngage

ORIENTAL VENEER PRODUCTS LIMITED

CIN: L35100MH1991PLC060686

Regd. Office: Survey No. 49, Village Aghai, via Kalyan Railway Station, Thane-421 301 Corp. Office: 16, Mascarenhas Road, Mazgaon, Mumbai-400 010, Maharashtra, India Tel. No.: 022-61389400; Fax No.: 022-61389401

Website: www.ovpl.co.in E-mail: compliance.ovpl@gmail.com NOTICE OF ANNUAL GENERAL MEETING AND E-VOTING NOTICE is hereby given that the 29th Annual General Meeting ('AGM') of the Members of Orienta eneer Products Limited ('the Company') will be held on Thursday, September 24, 2020 at 01.30

Standard Time ('IST') through Video Conferenc

'OAVM'), to transact the business set out in the Notice of the AGM, forming part of the Annual eport for the financial year ended March 31, 2020. in accordance with the circular issued by Ministry of Corporate Affairs dated May 05, 2020 real with circulars dated April 08, 2020 and April 13, 2020 (collectively referred to as "MCA Circulars") and SEBI Circular dated May 12, 2020, the Notice of the AGM along with Annual Report has been sent in electronic mode on August 31, 2020, to the Members whose e-mail addresses are registered with the Company / RTA / Depository Participants.

Please note that this documents are uploaded on the website of the Company www.ovpl.co.in, National Securities Depository Limited ('NSDL') at www.evoting.nsdl.com and the website of BSE Limited ('BSE') at www.bseindia.com.

Pursuant to Section 91 of the Companies Act, 2015 and SEBI (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will be closed from Thursday, September 17, 2020 to Thursday, September 24 (both days inclusive) for the purpose of payment of dividend for the year ended March 31, 2020 and also for the AGM of the Company.

If final dividend on Equity Shares, as recommended by the Board, if declared at the AGM, will be paid on or after September 24, 2020 as under :

To all Beneficial Owners in respect of shares held in electronic form, as per details furnished the Depositories for this purpose as at the end of the business hours on Wednesday

To all Members in respect of shares held in physical form, whose names are on the Company Register of Members after giving effect to valid transmission and transposition requests lodge with the Company before the end of business hours on Wednesday, September 16, 2020. Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management Administration) Rules, 2014, Regulation 44 of the Listing Regulations and Secretarial Standard or General Meetings, each as amended, the the Company is pleased to provide the facility of remote e-voting to its Members in respect of the Business to be transacted at the AGM. Additionally, the mpany is providing facility of voting through e-voting system during the AGM ("e-voting"). Th facility of casting votes by a member using remote e-voting system as well voting on the date o the AGM will be provided by NSDL.

. The remote e-voting shall commence on Monday, September 21, 2020 (10.00 a. m. IST) and ends on Wednesday, September 23, 2020 (05.00 p. m. IST). The remote e-voting module shall be disabled by NSDL for e-voting thereafter. Once the vote on a resolution is cast by the Member he / she shall not be allowed to change it subsequently

Members whose name is recorded in the Register of Members or in the Regist of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date viz. Friday September 18, 2020 will be entitled to avail the facility of remote e-voting as well as e-voting

. Any person who have acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Annual Report and holding shares as on the cut-off date may approach the Company or NSDL for issuance of the User ID and Password by sending a request a evoting@nsdl.co.in. However, if he / she is already registered with NSDL for remote e-voting then he / she can use his / her existing User ID and password for casting the vote.

The facility of e-voting during the AGM ("e-voting") can be availed by Members who have no

i. A Member can opt for only one mode of voting i.e. either through remote e-voting or e-voting system during the AGM ("e-voting"). . If a Member casts votes by both modes, then voting done through e-voting shall prevai

. The detailed procedure for remote e-voting / e-voting at AGM is provided in the Notice of the 29th AGM Mr. Shiv Hari Jalan, Practising Company Secretary, has been appointed as the Scrutinizer fo conducting the e-voting in a fair and transparent manner. The result shall be declared not later than 48 hours of from the conclusion of the AGM. Th

results declared along with the Scrutinizer's Report shall be placed on the Company's websit

www.ovpl.co.in and on the website of NSDL www.evoting.nsdl.com immediately after the resul s declared. The Company shall simultaneously forward the results to BSE Limited, where the ecurities of the Company are listed. n terms of MCA circular dated April 08, 2020, since the physical attendance of members ha

ended with, the facility for appointment of proxies by the members will not be available advance mentioning their name Demat account number / folio number, email ID, mobile number a

ompliance.ovpl@gmail.com by September 20, 2020. The same will be replied by the compan Any grievance relating to e-voting, may be addressed to National Securities Depository Limited Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel

Mumbai-400 013, E-mail : evoting@nsdl.co.in, Phone No. : (022) 2499 4600 / 1800-222-990. For Oriental Veneer Products Limited Place : Mumbai

Sonam Gupta Company Secretary Date : August 31, 2020



SATIN CREDITCARE NETWORK LIMITED

CIN:L65991DL1990PLC041796 Regd. Office: 5th Floor, Kundan Bhawan, Azadpur Commercial Complex, Azadpur Delhi-110033
Corporate Office: Floor 1 & 3, Plot No -97, Sector-44, Gurugram, Haryana-122003, India.

Phone: 0124-4715400, Website: www.satincreditcare.com E-mail: secretarial@satincreditcare.com

Extract of Statement of Consolidated Unaudited Financial Results for the Quarter ended on June 30, 2020

(₹ In Lakhs except					
S. No.	Particulars	Quarter Ended June 30, 2020	Previous Year Ended March 31, 2020	Quarter Ended June 30, 2019	
		Unaudited	Audited	Unaudited	
1	Total Income	31,055.27	1,50,343.19	35,315.50	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	1,715.40	21,162.64	6,431.83	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	1,715.40	21,162.64	6,431.83	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	1,276.48	15,497.26	4,085.75	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,821.38	19,979.73	4,929.16	
6	Equity Share Capital	_	5,171.27		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previ- ous year	_	1,39,697.64	-	
8	Earnings Per Share (₹10/- each) (for continuing and discontinued operations) -				
	Basic: Diluted:	2.47 2.47	30.43 30.27	8.40 8.17	

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit & Loss in accordance with Ind-AS Rules/AS Rules, Whichever is applicable.

(₹ In Lakhs)

	(* <u>_</u> ,					
Brief of Standalone Unaudited Financial Results for the Quarter ended on June 30, 2020						
S. No.	Particulars	Quarter Ended June 30, 2020	Previous Year Ended March 31, 2020	Quarter Ended June 30, 2019		
		Unaudited	Audited	Unaudited		
1	Total Income	28,952.30	1,40,090.41	33,292.65		
2	Profit Before Tax	1,735.68	21,316.76	6,497.01		
3	Profit After Tax	1,285.23	15,626.71	4,138.31		

The Company reports Standalone and Consolidated financial results on quarterly basis pursuant to the requirement under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended read with circular dated July 05, 2016. The Standalone & Consolidated financial results are available on the website of the Company (i.e. www.satincreditcare.com) and on the websites of the Stock Exchange(s) (i.e. NSE-www. nseindia.com and BSE- www.bseindia.com).

The above is an extract of the detailed format of unaudited Standalone & Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Results for Quarter ended on June 30, 2020 are in compliance with Indian Accounting Standards (IND-AS) notified by the Ministry of Corporate Affairs.

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of Satin Creditcare Network Limited ('the Company') at their meetings held on September 01, 2020 and September 02, 2020 respectively.

For Satin Creditcare Network Limited

Place: Delhi Chairman Cum Managing Director Dated: September 02, 2020 DIN No. 00333754

BLUE CHIP TEX INDUSTRIES LIMITED

CIN: L17100DN1985PLC005561 Registered Office: Plot No. 63-B, Danudyog Sahakari Sangh Ltd, Village Piparia, Silvassa, Dadra & Nagar Haveli – 396230 Corporate Office: Office no. 15 /16/ 17, 1 floor, Maker Chambers III, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai – 400021 Email Id: bluechiptex@gmail.com, Website: www.bluechiptexindustrieslimited.com, Tel. No.: 022-4353 0400

Notice of the 35th Annual General Meeting of the Company to be convened through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM), Book Closure, Record Date and Remote E-Voting Information

In compliance with the provisions of the Companies Act. 2013 and the requirements of the General Circular No. 20 / 2020 dated 5 May, 2020 issued by the Ministry of Corporate Affairs (hereinafter referred to as 'MCA Circular'), the 35th Annual General Meeting ("AGM") of Blue Chip Tex Industries Limited (the Company) will be held through Video Conferencing ("VC") or Other Audio Visua Means ("OAVM") on Tuesday, 29th September, 2020 at 12 noon to transact the Ordinary and Special Businesses as set out in the Notice dated 19th August, 2020 convening the AGM. On account of COVID-19 Pandemic and consequent lockdown in several parts of the Nation, the said MCA Circular has allowed the Companies to conduct their AGM through VC or OAVM in the manner provided in General Circular No. 14 / 2020 dated 8th April, 2020 and General Circular No. 17 / 2020 dated 13th April, 2020 issued by MCA. Accordingly in compliance with the requirements of the aforesaid MCA General Circulars, the Company is convening its 35th AGM through VC or OAVM, without the physical presence of the Members at a common venue.

The said MCA Circular dated 5th May, 2020 and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 has granted relaxations to the Companies, with respect to printing and dispatching of physical copies of Annual Report to shareholders. In compliance with the relevant circulars, the Notice convening the 35th AGM and Annual Report 2019-20 have been sent on 1 September, 2020 to the shareholders whose email ids are registered with the Company / Registrar and Share Transfer Agent (RTA) / Depository Participants (DPs) as on cut-off date i.e. Friday, 28th August, 2020. Those shareholders of the Company whose email ids are not updated with the Company / RTA / DPs can avail soft copy of the 35th AGM Notice and Annual Report of the Company for the financial year 2019-20 by raising a request to the Company at bluechiptex@gmail.com. Alternatively, the Notice of 35th AGM and Annual Report 2019-20 will also be made available on the Company's website i.e. www.bluechiptexindustrieslimited.com, on the website of CDSL i.e. www.evotingindia.com and on the website of BSE Limited i.e. www.bseindia.com. For updating the email ids of the members, the Company had availed the facility of its Registrar and Share Transfer Agent for sending

messages through sms service to those members whose mobile number were available with us, requesting them to update thei email id(s) with the Company / RTA / DP. Members are advised to register / update their e-mail address with their DPs in case of shares held in electronic form and to the

Company and / or its RTA in case of shares held in physical form for receiving all communications, including Annual Report, Notices Circulars etc.by email from the Company in future. Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015 (the Listing Regulations), the Register of Members and Share Transfer Books of the Company will remain closed

from Tuesday, 22nd September, 2020 to Tuesday, 29th September, 2020 (both days inclusive) for the purpose of AGM and to ascertai the names of members who will be entitled to receive dividend on the equity shares of the Company for the financial year 2019-20 if approved by members at the AGM. In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules

2014, as amended and Regulation 44 of the Listing Regulations and Secretarial Standard on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India, the Company is pleased to offer its members the facility of "remote e-voting" provided by the Central Depository Services (India) Limited (CDSL) to enable them to cast their vote by electronic means on all the resolutions as set out in the said Notice.

The details pursuant to provisions of the Companies Act, 2013 and the Rules framed thereunder are given below

a. the business as set out in the Notice of AGM may be transacted by electronic means; date and time of commencement of remote e-voting through electronic means: Saturday, 26th September, 2020 at 9:00 a.m.;

date and time of end of remote e-voting through electronic means: Monday, 28th September, 2020 at 5:00 p.m.; the cut-off date for determining the eligibility to vote by remote e-voting or e-voting at the time of the AGM is Tuesday, 22"

voting through remote e-voting shall not be allowed beyond 5.00 p.m. on Monday, 28th September, 2020;

any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off i.e. Tuesday, 22nd September, 2020, may obtain the login ID and password by sending a requestion at helpdesk evoting@cdslindia.com or bluechiptex@gmail.com. However, if any person is already registered with CDSL for -voting then existing user ID and password can be used for casting vote;

Members may note that: (i) the remote e-voting module shall be disabled by CDSL at 5.00 p.m. on Monday, 28th September, 2020 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (ii) Since the 35th AGM will be convened through VC / OAVM, the facility for voting through physical ballot paper will not be made available however members may cast their vote through e-voting which will be made available at the time of the AGM: (iii) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM through VC / OAVM but shall not cast their vote again: (iv) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail facility of remote e-voting as well as e-voting

at the time of AGM: and For the process and manner of remote e-voting, members may go through the instructions in the Notice convening the AGM and in case of any queries or issues regarding e-voting, members may refer the Frequently Asked Questions ("FAQ") and e-voting manual available at www.evotingindia.co. in under help section or write an email to helpdesk evoting@cdslindia.com. Members having any grievance connected with remote e-voting or e-voting at the time of AGM may contact Mr. Rakesh Dalvi, Manager, CDSL, by writing to him at A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East) Mumbai - 400013 or contact at 022-23058542.

Members who are holding shares in physical form or whose email addresses are not registered with the Company can cast their vote through remote e-voting or through the e-voting at the time of the meeting in the manner and following the instructions as mentioned in the Notes section of the Notice dated 19th August, 2020 convening the 35th AGM or refer the Public Notice appeared in English language newspaper viz. Business Standard and in Gujarati language newspaper viz. Western Times on Thursday, 20th

> By order of the Board of Directors For Blue Chip Tex Industries Limited Rhumit M Dharod Company Secretary

Place: Mumbai Date: 2nd September, 2020

યુરેનસ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ

CIN - L74110GJ1994PLC021352 રજિ. ઓફ્સિ :્૨૦૧, મૌલિક આર્કેડ, કર્ણાવતી પગરાખા બજારની ઉપર, માનસી ક્રોસં રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧પ ઇ-મેઇલ આઇ.ડી. : Info@yuranusinfra.com વેબસાઇટ : www.yuranusinfra.com, ટેલીફોન નં/ફેકસ નં. : ૦૭૯-૨૬૭૩૩૩૫૩.

નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે સિક્ચુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રીક્વાયરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ની નિયમન ૨૯(૧) (એ) અનુસાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મંગળવાર, ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ૩૧ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અંત ગાળા માટે કંપનીના અનઓડીટેડ નાણાકીય પરિણામોને ધ્યાનમાં રાખવા અને મંજૂર કરવા માટે મળશે.

આ નોટીસમાં સમાવિષ્ટ માહિતી www.yuranusinfra.com પર કંપનીની વેબસાઇટ પર અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ બીએસઈ www.bseindia.com પર પણ

તારીખ : ૪થી ફેબ્રુઆરી, ૨૦૨૦ સ્થળ : અમદાવાદં.

યુરેનસ ઇન્ફાસ્ટ્રકચર લિ.. સહી/- મોહિત દિનેશ દેસાઇ મેનેજીંગ ડીરેક્ટર

INDO CREDIT CAPITAL LIMITED

Regd.Office: 304, Kaling, B/h. Bata Show Room, Nr. Mt. Carmel School, Ashram Road, Ahmedabad.380009 Web: www.indocreditcapital.com CIN: L65910GJ1993PLC020651

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Friday, 11th September, 2020 at the registered office of the company to inter alia to consider and to approve the Unaudited Financial Results of the company for the quarter ended 30th June, 2020. This information is also available on the website of the company i.e. www.indocreditcapital.com and on the website of the stock exchange i.e www.bseindia.com.

For, Indo Credit Capital Limited

Place: Ahmedabad Date: 02/09/2020

Sd/-Ramkaran Saini Director (DIN: 00439446)

SONU III SONU સોના હી સોના જ્વેલર્સ (ગુજરાત)લિમિટેડ

CIN: L36910GJ2010PLC059513 **રજી.ઓફીસ**ઃ ૭, મિલેનિયમ પ્લાઝા, સ્વામિનારાયણ મંદિર સામે, માનસી ક્રોસ રોડ, વસ્ત્રાપુર, ામદાવાદ. ગુજરાત-૩૮૦૦૧૫. • Email: cs@sonahisona.com, Website: www.sonahisona.com વિડીયો કોર્ન્ફરન્સીંગ (VC) તથા અધર ઓડીયો વિઝયુઅલ મીન્સ (OAVM) ન માધ્યમ હારા 11 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બાબત સભાસદોને નોટીસ આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીઝ એક્ટ, 2013 ('એકટ') તથા તેમાં

નિર્દેશિત નિયમો અનુસાર તથા સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ તથા ડિસ્કલોઝર રીકવારયરમેન્ટ) રેગ્યુલેશન્સ, 2015 ને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (MCA સર્ક્યુલર્સ) દ્વારા જારી કરવામાં આવેલ જનરલ સર્ક્યુલર નં. 14/2020 (તા. 08-04-20) 17/2020 (તા. 13-4-20) તથા 20/2020 તા. 05-05-2020) તથા સિક્યુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ સર્ક્યુલર (સેબી સર્ક્યુલર) નં. SEBI/HO/CFD/CMD1/ CIR/P/2020/79 તા. 12-05-2020 સાથે વેંચાર્ણે લેતાં તેમાં નિર્દેશિત કોઈ એક સ્થળે એકત્રિત થયા વિના સભાસદોની ભૌતિક હાજરી વિના AGM બોલાવવા બાબતની દર્શાવેલ જોગવાઈઓ અનુસાર સોના હી સોના જ્વેલર્સ (ગુજરાત) લીમીટેડ (કંપની)ની વાર્ષિક સામાન્ય સભા તા. 28 સપ્ટેમ્બર, 2020, સોમવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 4.00 વાગે વિડીયો કોન્ફરન્સીંગ (VC) તથા અધર ઓડીયો વિઝયુઅલ મીન્સ (OAVM) ના માધ્યમ દ્વારા રાખવામાં આવી છે. 11 મી AGM ની નોટીસ તથા નાણાકીય વર્ષ 2019-20 નો એન્યુઅલ રીપોર્ટ ('એન્યુઅલ રીપોર્ટ') MCA સર્ક્યુલર્સ તથા સેબી સર્ક્યુલર્સના નિયમોને આધીન જેમના ઈ-મેઈલ એડ્રેસ કંપની સાથે અથવા સંબંધિત ડીપોઝીટરી પાર્ટીસીપેન્ટ ('ડિપોઝીટરી') સાથે ૨જીસ્ટર્ડ કરાવેલ હશે. તેવા જ સભ્યોને માત્ર ઈમેઈલ દ્વારા મોકલવામાં આવશે.

જે સભાસદોએ તેમના ઈ-મેઈલ એડ્રેસ ડિપોઝીટરી/ કંપની/ રજીસ્ટ્રાર કે શેર ટ્રાન્સફર એજન્ટ ('RTA') સાથે હજુ રજીસ્ટર્ડ કરાવેલ ન હોય તેમણે નીચે જણાવેલ રીતે રજીસ્ટર કરાવી લેવા:

(i) સંબંધિત ડિપોઝીટરી પાર્ટીસીપેન્ટ્સ થકી ડિપોઝીટરી પાસે ઈલેક્ટ્રોનિક કે ડીમેટ દ્વારા હોલ્ડીંગ ધરાવતા હોય તે સભ્યો કંપની સાથે નામ, DP ID, કલાયન્ટ ID, PAN મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ ID ની વિગતો cs@sonahisona.com ને ઈમેઈલ દ્વારા જણાવીને પોતાનું ઈ-મેઈલ રજીસ્ટર્ડ કરાવી શકશે.

(ii) કંપનીના બધા જ શેર્સ ડીમટીરીયલાઈઝ્ડ ફોર્મમાં હોય તે.

સભ્યો કંપનીની 11 મી AGM માં માત્ર VC/OAVM દ્વારા જ જોડાઈ શકશે અથવા તેમાં ભાગ લઈ શકશે. કંપની દ્વારા e-વોટીંગની સગવડતાની વ્યવસ્થા નેશનલ સિક્યુરીટીઝ ડિપોઝીટરીઝ લિમિટેડ ('NSDL') સાથે કરવામાં આવી છે. 11 મી AGM સાથે જોડાવાની, તેમાં ભાગ લેવાની, રીમોટ ઈલેક્ટ્રોનિક વોટીંગ કે ઈ-વોટીંગ સિસ્ટમ દ્વારા પોતાનો મત આપવાની- વગેરે બાબતોની વિગત 11 મી AGM ની નોટીસમાં આપવામાં આવી છે. VC/ OAVM દ્વારા 11 મી AGM માં ભાગ લેનાર સભ્યોની ગણતરી કંપનીઝ એકટ, 2013 ની કલમ 103 અનુસાર ફોરમમાં લેવામાં આવશે. 11 મી AGM ની નોટીસ તથા એન્યુઅલ રીપોર્ટ કંપનીની વેબસાઈટ www.sonahisona.com તથા NSE ની વેબસાઈટ www.nseindia.com પર પ્રાપ્ય છે.

AGMમાં વોટીંગના હક ધરાવવાના હેતુ માટે તથા તા. 31 માર્ચ, 2020 ના રોજ પૂર્ણ થતા નાણાકીય વર્ષ માટે યોગ્યતા ધરાવનાર સભ્યો નિયત કરવા માટેની રેકોર્ડ તારીખ 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર નક્કી કરવામાં આવી છે.

ઉપરોક્ત માહિતી સભ્યોના હિતને અનુલક્ષીને તે જાણ કરવાના હેતુએ આપેલ છે. જે MCA સર્ક્યુલર્સ તથા સેબી સર્ક્યુલર્સમાં નિર્દિષ્ટ સૂચનાઓ અનુસાર છે.

તારીખ : ૦૩-૦૯-૨૦૨૦ સ્થળ : અમદાવાદ

સોના હી સોના જ્વેલર્સ (ગુજરાત) લિમિટે**ડ,** વતી ા હા સાના જવલસ (ગુજરાત) ાલામટડ, વતા સહી/- ફલક પટેલ (કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફિસર)

આશિમા લીમીટેડ CIN: L99999GJ1982PLC005253

૨:૧૧૨૮૬ ઓકીસ: ટેક્સલન્સ કોમ્પલેસ. ખોખરા – મહેમદાવાદ. અમદાવાદ–૩૮૦ ૦૨૧ **ફોન** : +૯૧-૭૯-૬૭૭૭૭૦૦૦, ફેક્સ : +૯૧-૭૯-૨૨૭૭૩૦૬૧ धभेष्ठतः investor redressel@ashima.in वेजसाधः: www.ashima.in

નોટીસ

આથી નોટીસ આપવામા આવે છે કે કોવીડ-૧૯ મહામારીના સતત ફેલાવાને ધ્યાનમાં રાખીને અને આ સબંધમાં એમસીએ અને સેબી દ્વારા જારી કરાયેલ પરિષત્રો સાથે વંચાતા કંપની કાયદા,૨૦૧ ૩ની જોગવાઇઓ, તે હેઠળ રચાયેલ નિયમો સેબી એલઓડીઆર રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના અનુપાલન હેઠળ કંપનીના સભ્યોની ૩૭મી વાર્ષિક સામાન્ય સભા "'એજીએમ") **મંગળવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારે ૧૧ઃ૩૦** કલાકે વિડીયો કોન્કરન્સ ''વીસી.'') / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (''ઓએવીએમ'') દ્વારા એજીએમની નોટીસમા જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે

કંપનીએ જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ, કંપની, રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ એટલે કે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા લીમીટેડ (આરટીએ) અને ડિપોઝીટરીઓ પાસે રજીસ્ટર્ડ છે તેમને ૩૭મી એજીએમની નોટીસ અને ૩૧મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પુરા થતાં વાર્ષિક અહેવાલ ગુરુવાર, ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સેન્ટ્રલ ડિપોઝીટરી સિક્યોરીટીઝ લીમીટેડ (''સીડીએસએલ '') દ્વારા ઇમેઇલથી મોકલ્યા છે.

એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.ashima.in</u>૫૨ અને સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com અને સ્ટોક એક્સચેન્જો એટલેકે બીએસઇ અને એનએસઇની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

વધુમાં એ પણ નોટીસ આપવામા આવે છે કે, કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૯૧ સાથે વંચાતા કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૦ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોજર રીક્વાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૨ મુજબ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ સોમવાર, ૨૧

સપ્ટેમ્બર ,૨૦૨૦ થી મંગળવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી (બંને દિવસો સહીત) બંધ રહેશે. કંપની કાયદા. ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઇઓ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો. ૨૦૧૪ ન નિયમ ૨૦ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ના નિયમન ૪૪ અંતર્ગત કંપનીએ એજીએમની નોટીસમાં જણાવેલ ઠરાવો પર વોટીંગ માટે ઇ-વોટીંગ સવલત પુરી પાડવા માટે સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ(ઇન્ડિયા)લીમીટેડ(''સીડીએસએલ'')ની નિમણુંક કરી છે. કટ–ઓફતારીખ એટલે કે મંગળવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ ફ્રીઝીકલ અથવા ડિમટીરીયલાઝ્ડ સ્વરૂપે શેરો ધરાવતા કંપનીના સભ્યો ઇલેક્ટ્રોનિક

રીતે તેમના મતો આપી શકે છે. રીમોટ ઇ-વોર્ટીંગનો સમયગાળો શનિવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારે ૯.૦૦ કલાકે શરૂ થશે અને સોમવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પુર્ણ થશે. ત્યારબાદ વોટીંગ માટે રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ સીડીએસએલ દ્વારા બંધ કરવામાં આવશે. જે સભ્યોએ રીમોટ ઇ-વોટીંગથી તેમના મતો આપ્યા નથી તેઓ એજીએમમાં તેમના મતો આપી શકે છે. સભ્યો રીમોટ ઇ-વોટીંગ દ્વારા મત આપવાના તેમના હકનો ઉપયોગ કર્યા પછી પણ એજીએમમ ભાગ લઇ શકે છે. પરંત એજીએમમાં કરીથી મત આપવાની પરવાનગી મળશે નહી.

એજીએમનો મેઇલ કર્યા પછી અને કટ–ઓફ તારીખ એટલે કે ૨૨ સપ્ટેમ્બર .૨૦૨૦ પહેલા કંપનીના શેરો પ્રાપ્ત કરના અને કંપનીની સભ્ય બનનાર વ્યક્તિ એજીએમની તારીખે એજીએમની નોટીસમાં જણાવેલ પ્રક્રિયા અનુસરીને બંને ઇલેક્ટ્રોનિક રીતો એટલ કે રીમોટ ઇ-વોટીંગ અને ઇ-વોટીંગ પદ્ધતિથી તે / તેણીનો મત આપવા હકદાર ગણાશે. જે સભ્યોએ તેમના ઇમેઇલ આઇડી / બેંક એકાઉન્ટ વિગતો / મોબાઇલ નંબર વગેરે ૨જીસ્ટર્ડ કરાવ્યા નથી તેમને શેરહોલ્ડર્સ ઇર્ન્ફ્સિમેશન અને ડિસક્લોજર્સ ટેબ હેઠળ કંપનીની વેબસાઇટ <u>www.ashima.in</u>ની અને લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડના પોર્ટલ https://linkintime.co.in/emailreg/email_registehtml અને કંપનીનારજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટની મુલાકાત લઇને તેમની વિગતો સુધારાવવા અને ડિમેટ સ્વરૂપે શેરો ધરાવતા હોય તેમને તેમના લાગતાવળગતા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટનો સંપર્ક કરવા વિનંતી છે.

સભ્યો જેમણે વીસી / ઓએવીએમ દ્વારા એજીએમમાં ભાગ લેવા માટે મદદ ઇચ્છે છે તેઓ શ્રી રાકેશ દલવી, મેનેજર, ૨૫મો માળ, એ વિંગ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ્સ કંપાઉન્ડ, એનએમ જોષી માર્ગ, લોઅ૨૫રેલ (ઇ), મુંબઇ ૪૦૦૦૧૩, ઇમેઇલ આઇડી : helpdesk.evoting@cdslindia.com ટેલિફોન નં. ૧૮૦૦૨૨૫૫૩૩ નો સંપર્ક કરી શકે છે. કોઇપણ પુછપરછના કિસ્સામાં, સભ્યો <u>www.evotingindia.com</u>પર ઉપલબ્ધ વારંવાર પુછાતા પ્રશ્નો (''એફએક્યુએસ'') અને શેરહોલ્ડરો માટેના ઇ-વોટીંગ યુઝર મેન્યુઅલ જોઇ શકો છે.

આશિમા લીમીટેડ વતી સ્થળ : અમદાવાદ દિપક ઠાકર તારીખ : 03.0૯.૨0૨0 કંપની સેક્રેટરી

: અમદાવાદ

પર પણ ઉપલબ્ધ થશે.

સ્થળ : અમદાવાદ

તારીખ : ૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૦

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

<u>એલએચબી વ્હીલ સેટ્સનું</u>

<u>નોન-ડિસ્ટ્રક્ટીવ ટેસ્ટીંગ (એનડીટી)</u>

ાગ્ય કોન્ટ્રાક્ટરો પાસે થી નીચે જણાવેલ કાર્ય માં

-ટેન્ડર આમંત્રિત કરવામાં આવે છે. **ઈ-ટેન્ડર નોટીસ નં**

આરએમ(એમ)એડીઆઈ/03/2020-21 તા.31-

08-2020. **ટેન્ડર નં.** એમ 442/ 19/એનડીટી,

કેએફ/2019-20. **(1) કામનું નામઃ** એક વર્ષન

ામયગાળા માટે કોચિંગ ડેપો, કાંકરીયા ખાતે એલએસલ

ચ્હીલ સેટ્સના નોન-ડિસ્ટ્રકટીવનું કોન્ટ્રાક્ટ કાર્ય. **(2)**

કા**મની અંદાજીત કિંમતઃ** ₹ 42.52.418/- (૩પિ

નેતાળીસ લાખ બાવન હજાર ચાર સો અઢાર પૂરા) **(**3)

ઈએમડીઃ ₹ 85,100/-(રૂપિયા પંચ્યાસી હજાર એક સં

પૂરા) **(4) ટેન્ડર બંધ થવાની અને ખુલવાની તારીખ**

અને સમયઃ ટેન્ડર તા.30-09-2020 ના 15:00

કલાકે બંધ થશે અને તા.30-09-2020 ના 15:30

કલાકે ટેન્ડર ખોલાશે. **(5) વેબસાઈટ વિગત, નોટીસ**

બોર્ડનું સ્થળ જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ શકાશે અને ટેન્ડઃ

આમંત્રણ સત્તાધિકારીની ઓફીસનું સરનામુંઃ ડિવિઝનલ

રેલવે મેનેજર (મિકેનિકલ), (પશ્ચિમ રેલવે), મિકેનિક

અમને ફોલો કરોઃ 🚩 twitter.com/WesternRly

: ०२.०७.२०२०

ISL CONSULTING LIMITED

(CIN : L67120GJ1993PLC086576) રજીસ્ટર્ડ ઓફિસઃ- ૫૦૧, પાંચમો માળ, અભીજીત-૨, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક ઉપર, મીઠાખળી છ રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોન : ૦૭૯-૪૦૦૩૦૩૫૧, ૦૭૯-૪૦૦૩૦૩૫૨, કેક્સ : ૦૭૯-૩૦૦૭૭૩૫૨, E-mail: innogroup@gmail.com.

Website: www.islconsulting.in ર૮મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે, ૨૮મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) મંગળવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈએસટીમાં વિડિઓ કોન્કરન્સિંગ (વીસી) અથવા ખન્ય ઓડીયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા યોજાવાની છે. કંપની એક્ટ, ૨૦૧૩ની લાગુ જોગવાઈઓ સાથે અને સામાન્ય પરિપત્ર નં . ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦માં તારીખ ૮મી એપ્રિલ,૨૦૨૦, ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને ૫ મે, ૨૦૨૦ના અનુક્રમે, એમસીએ અને સર્ક્યુલર નં.SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨ મે, ૨૦૨૦ ના રોજ સેબી દ્વારા જારી કરાયેલ, સ્થળ પર સભ્યોની હાજરી વગર.

વીસીના માધ્યમથી એજીએમમાં હાજરી આપવા, ઇલેક્ટ્રોનિક માધ્યમથી એજીએમ પર તેમના મત વાસાના માધ્યમથા અજીએમમાં હાજરા આપવા, ઇલક્ટ્રાનક માધ્યમથા અજીએમ પર તમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરવા અને સભ્યોને એજીએમ પૂર્વે અને તે દરમિયાન રિમોટ ઇ-વોટિંગ કારા વ્યવસાય ટ્રાન્સેક્ટેડ કરવામાં આવશે તેવી કંપનીને ખુશી છે. કટ-ઓફ તારીખ પ્રમાણે એટલે કે મંગળવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શેર ધરાવતા સભ્યો, કંપનીમાં તેમનો ઇ-મેઇલ સરનામું ઉપલબ્ધ ન હોવાને કા્રણે વાર્ષિક અહેવાલની ઇલેક્ટ્રોનિક નક્લ પ્રાપ્ત નહીં કરનારાઓ સહિત તેમના અધિકારના ઉપયોગનો ઉપયોગ કરી શકે છે. એજીએમ નોટિસમાં આપવામાં આવશે તેવી સૂચનાનું પાલન કરીને મત આપો.

જે સભ્યોએ તેમના ઇમેઇલ સરનામાંઓ નોંધાવ્યા નથી, કંપની https:// www.purvashare.com/email-and- iPhone-updation/ પર કંપનીના આરટીએ સાથે ઇમેઇલ સરનામાંઓને નોંધણી / અપડેટ કરવાની સુવિધા આપી છે.

શેરહોલ્ડરોની પ્રક્રિયા કે જેની ઇમેઇલ સરનામાંઓ નોટિસમાં સૂચિત ઠરાવો માટે ઇ-વોટિંગ માટે લોગીન ઓળખપત્રો મેળવવા માટે ડિપોઝિટરીઝ/આરટીએ સાથે તે નોંધાયેલ નથીઃ

લીગીલ આંઇાબપમાં મેઇાવવા માટે ાગ્યાઝેલ્ટાગું ખારકાર કરે કોલિયો નંબર, શેરહોલ્ડરનું નામ, ૧. જો ફીઝીકલ સ્થિતિમાં શેર રાખવામાં આવે છે, તો કૃપા કરીને ફોલિયો નંબર, શેરહોલ્ડરનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્ત્ર-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (સ્વ-પ્રમાણિત સ્કેન) (આધાર કાર્ડની સ્કેન્ સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ) innogroup@gmail.com પર ઇમેઇલ દ્વારા પ્રદાન કરો .

ર. કિસ્સામાં, શેર ડીમેટ મોડમાં રાખવામાં આવે છે, કૃપા કરીને DPID-CLID (૧૬ અંકનો DPID CLID અથવા ૧૬ અંકનો DPID, નામ, ક્લાયંટ માસ્ટર અથવા કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાન કાર્ડની સ્વયં પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્કેન સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ)ને innogroup@gmail.com પર પ્રદાન કરો) કાડના સ્કન સ્વ-પ્રમાણત સ્કન કરવા નકલા નુના mnogroup@gmail.com પર પ્રદાન કરા) ૨૦૧૯-૨૦ના વાર્ષિક અહેવાલની ઇલેક્ટ્રોનિક નકલ જેમાં વીસી અને ઇ-વોર્ટિંગ દ્વારા એજીએમમાં હાજરી આપવાની પ્રક્રિયા અને રીત શાર્મલ છે જેમના ઇ-મેઇલ સરનામાંઓ ડિપોઝિટરી / સાથે રજીસ્ટર થયેલ છે. તેનો સમાવેશ તમામ સભ્યોને નિયત સમયે મોકલવામાં આવશે, આરટીએ. વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.islconsulting.in પર અને સ્ટોક એક્સચેંજ પર www.bseindia.com પર પણ મળશે.

મારફતે મંગળવાર, તારીખ રહ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે ચોજવામાં આવશે.

આઇએસએલ કન્સલ્ટિંગ લીમીટેડ વતી સહી/- અંક્તિ જે. શાહ મેનેજીંગ ડીરેક્ટર (ડીન - ૦૨૬૯૫૯૮७)

क्राहेर नोटीस

આથી નોટીસ આપવામાં આવે છે કે અર્થિત ઓર્ગેનોસિસ લિમિટેકના સભાસદોની રહમી વાર્ષિક સાધારણ સભા (**'એજીએમ')** કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા જારી તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૫ મે, ૨૦૨૦ ના અને સેબી દ્વારા જારી તારીખ ૧૨ મે, ૨૦૨૦ ના સરક્યુલર સાથે વાંચતા અને અનુસરતા વિકિયો કોન્ફરન્સીંગ **('વીસી')** / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો **('ઓએવીએમ')**

ઉપરોક્ત સરક્યુલરની પૂર્વતા કરતા કંપની દ્વારા કંપનીના સભાસદોને વીસી / ઓએવીએમ દ્વારા ચોજાતી એજીએમ માં હાજરી આપવાની સુવિદા તેમજ સભા દરમ્યાન ઈલેક્ટ્રોનિક માદયમથી વોટીંગ કરવાની સુવિદા પુરી પાડવામાં આવશે. જે સભાસદો કટ ઓફ તારીખ (એટલે કે ૨૨.૦૯.૨૦૨૦) શેર ધરાવતા હોય તેમજ જે સભાસદોના ઈમેઈલ આઈડી કંપની / આરટીએ પાસે નોંધાયેલા ના હોવાથી વાર્ષિક અદેવાલોની

ઈલેક્ટ્રોનિક કોપી ન મળેલ હોય તેવા સભાસદો સહીતના સભાસદો એજીએમ નોટીસમાં આપેલ સૂચનાઓને અનુસરીને તેમનો વોટ આપી શકશે.

હાલની કોવિડ–૧૯ ની વિશ્વવ્થાપી મહામારીની પરિસ્થિતિ અને ઉપરોક્ત સરક્યુલરને ઘ્યાનમાં રાખતા નાણાંકીય વર્ષ ૨૦૧૯–૨૦ વાર્ષિક

નાણાંકીય અહેવાલો, જેમાં સામેલ છે એજીએમ સભાની નોટીસ જે સભાસદોના ઈમેઈલ આઈડી કંપની / આરટીએ પાસે નોંધાયેલા છે તે બધા જ

સભાસદોને તેમના રજીસ્ટર્ડ ઈમેઈલ આઈડી ઉપર મોકલવામાં આવશે. આથી જે સભાસદોના ઈમેઈલ આઈડી કંપની / આરટીએ પાસે નોંધાયેલા

નથી તેમને વિનંતિ કે તેઓ કંપની પાસેથી ઈ–કોમ્યુનિકેશન મેળવીને તેમજ નીચે જણાવેલ પ્રક્રીયા અનુસરીને તેમના ઈમેઈલ આઈડી નોંધાવવા.

જરૂરી વિગતો જેવીકે, ફોલીચો નંબર, સભાસદનું નામ અને સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડ અને આધાર કાર્ડની કોપી સહીત ઇમેઈલ મોકલવો.

બ. જે સભાસદો તેમના શેર ડીમેટમાં ધારણ કરતા હોચ તેમણે તેમનો ઈમેઈલ આઈડી નોંધાવવા તેમના ડિપોઝીટરી પાર્ટીસીપન્ટનો સંપર્ક કરવો.

વાર્ષિક સાધારણ સભાની નોટીસ કંપનીની વેબસાઈટ www.architorg.com તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com

જે સભાસદો તેમના શેર ભૌતિક સ્વરૂપમાં ધારણ કરતા હોય તેમણે તેમનો ઈમેઈલ આઈડી નોંધાવવા share@architorg.com ઉપર

અર્ચિત ઓર્ગેનોસિસ લિમિટેડ

રજી. ઓફિસઃ પ્લોટ નં. ૨૫/૯-એ, ફેઝ-III, જી.આઈ.ડી.સી. નરોડા, અમદાવાદ-૩૮૨૩૩૦. ફોન ઃ 079-26873340

E-Mail: share@architorg.com Website: www.architorg.com CIN: L24110GJ1993PLC019941

લેસ્ટર્ને ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

BOARD MEETING TYPHOON FINANCIAL SERVICES LTD.

This is to inform you that the Board of Directors of the Company will meet on 14th September, 2020 for taking on record the Unaudited Financial Results for the quarter ended on 30thJune, 2020.

City Pulse Multiplex Limited (CIN: U92199GJ200PLC037606)

Registered Office: 401 4th Floor Sachet-1 Swatik Cross Road Ahmedabad-380 009. • Website: www.wowcinepulse.com l Ph.: 079-40070706 / 708 I Email: cs@wowcinepulse.com NOTICE

Ph.: 079-40070706 / 708 | Email : cs@wowcinepulse.com

Notice is hereby given that the 20th Annual General Meeting (AGM) of the members of the Company will be held on Friday, September 25, 2020 at 11.30 am at Registered office of the Company through video conferencing (VC) / Other Audio Visual Means (OAVM) facility (E-copy available at www.wowcinepulse.com)

The AGM will be held through VC / OAVM in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with Circular No. 14/2020 dated April 8, 2020. Circular No. 17/2020 dated April 13, 2020 and circular No. 20/2020 dated May 5, 2020 issued by securities and Exchange Board of India (SEBI), permitting the holding of AGM through VC / OAVM without Physical presence of member at a common venue.

In compliance with the above circular. E-copy of Notice of AGM alongwith Annual Report of F.Y. 2019-2020 has been sent to all the Share holders whose email address are registered with the Company / Depositary Participant(s).

Further, pursuant to Section 108 of the Companies Act, 2013 read with Proviso to rules 20(2) of Companies (Management and Administration) Rules, 2014 as amended, the Board is of opinion that the company being listed on SME Platform of BSE, specific exemption from e-voting facility should be claimed and thus have resolved not to provide e-voting facility for the ensuring AGM.

The facility for voting shall be made available at the meeting for the members attending the meeting and details procedure for voting at e-AGM mentioned in the Notes to Notice of the meeting. Share Transfer books shall remain closed from September 18, 2020 to September 25, 2020 (both days inclusive).

In case of any queries / grievances the members / benefocial owners may contact at the following address:

(a) Accurate Registry Sergvices (RTA) - +91-79-48000319 I investor@accuratessecurities.com / accurate.rta@gmail.com (b) Secretarial Department - 079-40070706 I

email : cs@wowcinepulse.com

By the Order of the Board of Directors

Admedabad

Sd/- Arpit Mehta Managing Director (DIN : 00213945)

વતી, અર્થિત ઓર્ગેનોસિસ લિમિટેડ

સહી / - કંદર્પ કે. અમિન ચેરમેન અને હોલ ટાઈમ ડાયરેક્ટર

નામ બદલેલ છે મે મારૂ નામ જચશીલ **દાર્મે**શ **મોદી** હતું જે બદલીને જચશીલ ધર્મેશભાઈ મોદી કરેલ છે. સરનામું : ૩૦૧, ગુલમોહર, બોડકદેવ, અમદાવાદ

નામ બદલેલ છે

મે મારૂ નામ સિપાહી મોહસિન સરૂમિયા હતું જે બદલીને પઠાણ મોહસિનખાન સરૂમિયા કરેલ છે. સરનામું : ૧ જે.પી. કવાટર્સ, એ.એમ.ટી.એસ. ઓફીસ સામે, જમાલપુર, અમદાવાદ

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED

CIN: L55100GJ1991PLCO15839 Regd. Office: International Airport Circle Ahmedabad -382475 Web: www.rmhil.com. email: royalemanorhotels@rediffmail.com, Telefax: 079-22868641

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Saturday, 12th September, 2020 at the registered office of the company to inter alia, to consider and approve the Unaudited Financial Results of the company for the guarter ended 30th June, 2020. This information is also available on the website of the company i.e. www.rmhil.com and on the website of the stock exchange i.e www.bseindia.com.

> For Royale Manor Hotels & Industries Limited Sd/-

Place: Ahmedabad Sunil Trivedi Date: 02/09/2020 Company Secretary

Form No. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Act

[Pursuant to section 374(b) of the companies Act, 2013 andrule 4(1) of the companies (Authorised to Register) Rules,2014] Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is

proposed to be made after fifteen days hereof but before thirty days at Central Registration Centre, Institute of Corporate Affairs (IICA), Plot no. 6, 7, 8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana - 122050 that **M/s Su Dev Jewels** (Firm Registration No.: GUJAH100098) a partnership Firm business entity may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.

The principal objects of the company are as follows: To carry on in India or elsewhere the business of goldsmiths silver smiths, jewelers, gem and diamond merchants and of producing, acquiring and trading, importing, exporting, buying, selling in all kind of metals, bullion, gold, silver, platinum, diamonds, precious stones and pearls and other complimentary item including but not limited to watches sunglasses etc.
A copy of the draft Memorandum and Articles of Association

of the proposed company may be inspected at the office at Hrishikesh building, Near IDBI char Rasta, Gulbai Tekra road, Off. C.G. Road, Ahmedabad-380006

Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing tothe Registrar at Central Registration Centre, Institute of Corporate Affairs (IICA), Plot no. 6, 7, 8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana - 122050, India within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Dated this 30th Day of August, 2020

On behalf of Su Dev Jewels Bhavesh Kamdar Devashish Kamdar

બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

CIN: L17100DN1985PLC005561

રજી ઓફ્સિઃ પ્લોટ નં.૬૩-બી, દાનુયુગ સંસ્કારી સંઘ લી. ગામ પીપરીયા, સીલવાસા, દાદરા અને નગર હવેલી-૩૯૬૨૩૦ કોર્પોરેટ ઓફીસ : ઓફીસ નં.૧૫/૧૬/૧૭, પહેલો માળ, મેકર ચેમ્બર્સ - III, જમનાલાલ બજાજ રોડ, નરીમન પોઇન્ટ, મુંબઇ-૪૦૦૦૨૧ દમેદલ આદકી : bluechiptex@gmail.com વેબસાઇટ : www.bluechiptexindustrieslimited.com ફોન નં. ૦૨૨-૪૩૫૩ ૦૪૦૦

વિડિઓ કોન્ફરન્સીંગ (વીસી) અથવા અન્ય વિડિયો વિઝ્યુઅલ મીન્સ (ઓએવીએમ), બુક બંધ, રેકોર્ડની તારીખ અને રિમોટ ઇ-મતદાન માહિતી દ્વારા બોલાવવામાં આવેલી કંપનીની ૩૫મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓનું પાલન અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્ર નંબર ૨૦/૨૦૨૦, પ મે, ૨૦૨૦ (ત્યારબાર્દ 'એમસીએ તરીકે ઓળખાય છે) પરિપત્ર બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ની ૩૫ મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ), વીડિયો કોન્ફરન્સિંગ (વીસી) અથવા અન્ય વિડિયો વિઝ્યુઅલ મીન્સ (ઓએવીએમ) દ્વારા **૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ને મંગળવારે બપોરે ૧૨ વાગ્યે** યોજાશે. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ના એજીએમને બોલાવવાની નોટિસમાં નિર્ધારિત મુજબના સામાન્ય અને વિશેષ વ્યવસાયોનો વ્યવહાર કરવા માટે નક્કી કરાયા હતા. રાષ્ટ્રના કેટલાંક ભાગોમાં કોવિડ -૧૯ રોગચાળો અને પરિણામે લોકડાઉનને કારણે, એમસીએ પરિપત્ર દ્વારા કંપનીઓને ૮મી એપ્રિલ, ૨૦૨૦ના સામાન્ય પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦માં પૂરા પાડવામાં આવેલી તે અનુસંધાને વીસી અથવા ઓએવીએમ દ્વારા તેમની એજીએમ કરવાની મંજૂરી આપી છે. અને સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તા .૧૩ એપ્રિલ, ૨૦૨૦, એમ.સી.એ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. **ઉપરોક્ત એમસીએ જનરલ પરિપત્રોની જરૂરિયાતોનું પાલન કરવાના હેતુ મુજબ,** કંપની કોઈ સામાન્ય સ્થળે સભ્યોની શારીરિક હાજરી વિના, વીસી અથવા ઓએવીએમ દ્વારા, ૩૫મી એજીએમ

એમસીએના પરિપત્ર તા. પમી મે, ૨૦૨૦ અને સેબીના પરિપત્ર નંબર સેબી / એચઓ / સીએફડી / સીએમડી ૧ / સીઆઈઆર પી / ૨૦૨૦ / ૭૯ તારીખ, તા.૧૨ મે, ૨૦૨૦ ના અનુસાર શરધારકાન વાાપક અહવાલના ભાતક છાપવા અને મોકલવાના સંદર્ભમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.સંબંધિત પરિપત્રોનું પાલન કરીને ૩૫ મી એજીએમ અને વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ બોલાવવાની નોટિસ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ તે શેરહોલ્ડરોને મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ આઇડી કંપની / રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) / ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા છે (ડીપી) કટ-ઓફ ડેટ પર એટલે કે શુક્રવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦. કંપનીના એવા શેરહોલ્ડરો, કે જેમના ઇમેઇલ આઇડી કંપની / આરટીએ / ડીપી સાથે અપડેટ નથી, તેઓ ૩૫ મી એજીએમ નોટિસ અને વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ ની સોફ્ટ કોપી bluechiptex@gmail.com પર કંપનીને વૈકલ્પિક રીતે મોકલીને વિનંતી કરીને મેળવી શકે છે. ૩૫મી એજીએમ અને વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ની નોટિસ પણ સીડીએસએલ એટલે કે www.evotingindia.com વેબસાઇટ અને બીએસઈ લિમિટેડ www.bseindia.com તેમજ કંપનીની વેબસાઇટ એટલે કે www.bluechiptexindustrieslimited.com પર ઉપલબ્ધ કરવામાં આવશે.

સભ્યોના ઇમેઇલ આઈડીઓને અપડેટ કરવા માટે, કંપનીએ જે સભ્યોનો મોબાઈલ નંબર અમારી સાથે ઉપલબ્ધ હતો તેમને એસએમએસ સેવા દ્વારા સંદેશા મોકલવા માટે તેના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટની સુવિધા મેળવી હતી, તેમની વિનંતી સાથે કંપની / આરટીએ / ડી.પી. પર તેમના ઇમેઇલ આઈડી(ઓ) ને અપડેટ કરવા વિનંતી કરી હતી.

સભ્યોને સલાહ આપવામાં આવે છે કે વાર્ષિક અહેવાલ, સૂચનાઓ સહિતના તમામ સંદેશાવ્યવહાર પ્રાપ્ત કરવા માટે ભૌતિક સ્વરૂપમાં રાખવામાં આવેલા શેરના કિસ્સામાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને કંપની અથવા / અથવા તેના આરટીએ પાસે રાખવામાં આવેલા શેરના કિસ્સામાં તેમના ડીપી સાથે તેમના ઇ-મેઇલ સરનામાંને રજિસ્ટર / અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે, પરિપત્રો વગેરે ભવિષ્યમાં કંપની તરફથી ઇમેઇલ કરવામાં આવશે.

કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૯૧ અને સેબીના નિયમન ૪૨ (લિસ્ટિંગ ઓબિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫, (લિસ્ટિંગ રેગ્યુલેશન્સ)ના અનુસંધાનમાં, કંપનીના સભ્યોની રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ મંગળવાર ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૦ થી મંગળવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦થી બંધ રહેશે. (બંને દિવસો સહિત) જો એજીએમ ખાતેના સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવે તો નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે કંપનીના ઇક્વિટી શેર પર ડિવિડન્ડ મેળવવા માટે તેવા સભ્યોના નામની ખાતરી કરવા હકદાર રહેશે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની શરતોમાં, કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના

નિયમ ૨૦ સાથે વાંચો, જે લિસ્ટિંગ રેગ્યુલેશન્સ અને સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ પરની સામાન્ય સભાઓ (એસએસ -૨)ની ૪૪ની સુધારણા અને રેગ્યુલેશન ૪૪ સાથે વાંચવામાં આવી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઈન્ડિયા દ્વારા, કંપની તેના સભ્યોને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) દ્વારા પૂરા પાડવામાં આવેલ ''રિમોટ ઇ-વોટિંગ'' ની સુર્વિધા ઓફર કરવામાં આવે છે જેથી તેઓ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરી શકે. ઉપરોક્ત સૂચનામાં જણાવેલ તમામ ઠરાવો.

કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ની જોગવાઈઓ અને તે મુજબના નિયમોના આધારે વિગતો નીચે આપેલ છેઃ એજીએમની સૂચનામાં જણાવ્યા મુજબનો વ્યવસાય ઇલેક્ટ્રોનિક માધ્યમથી વ્યવહાર થઈ શકે છે;

ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા રિમોટ ઇ-મતદાન શરૂ થવાની તારીખ અને સમયઃ શ**નિવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ સવારે ૯:૦૦** સી.

ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા રિમોટ ઇ-મતદાન સમાપ્ત થવાની તારીખ અને સમયઃ **સોમવાર, ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ બપોરે** ૫:૦૦ કલાકે;

એજીએમ સમયે રિમોટ ઇ-વોટિંગ અથવા ઇ-વોટિંગ દ્વારા મત આપવાની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ મંગળવાર,

૨૨ સપ્ટેમ્બર. ૨૦૨૦ છે: રિમોટ ઇ-વોટિંગ દ્વારા મતદાનને ૦૫.૦૦ વાગ્યે આગળ મંજૂરી આપવામાં આવશે નહીં. સોમવારે, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦;

એફ. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો ધારણ કરે છે અને એજીએમની સૂચના મોકલ્યા પછી અને કટ-ઓફ એટલે કે મંગળવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ શેર ધરાવે છે, તે પછી કંપનીનો સભ્ય બને છે, તેવા સભ્યો helpdesk.evoting@ cdslindia.com અથવા bluechiptex@gmail.com પર વિનંતી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે, જો કોઈપણ વ્યક્તિ પહેલેથી જ ઇ-વોટિંગ માટે સીડીએસએલ સાથે નોંધાયેલ છે, તો હાલના વપરાશકર્તા આઈડી અને પાસવર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે કરી શકાય છે; સભ્યો નોંધી શકે છે કેઃ (i) રીમોટ ઇ-મતદાન મોડ્યુલ સીડીએસએલ દ્વારા સોમવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૦ પ.૦૦ વાગ્યે

બંધ કરવામાં આવશે. અને સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવ્યા પછી, સભ્યને તે પછીથી બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં; (ii) ૩૫મી એજીએમ વીસી / ઓએવીએમ દ્વારા બોલાવવામાં આવશે, તેથી ભૌતિક બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે નહીં, જોકે સભ્યો ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપી શકે છે, જે એજીએમ સમયે ઉપલબ્ધ કરાશે. (iii) જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તે વીસી / ઓએવીએમ દ્વારા પણ એજીએમમાં હાજર થઈ શકે છે પરંતુ ફરીથી પોતાનો મત આપી શકશે નહીં; (iv) કોઈ વ્યક્તિ કે જેનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભકારક માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલ છે, તે ફક્ત રિમોટ ઇ-વોટિંગની સુવિધા એજીએમ સમયે તેમજ ઇ-મતદાનના હકદાર રહેશે ; અને એચ.રિમોટ ઇ-વોર્ટિંગની પ્રક્રિયા અને રીત માટે, સભ્યો એજીએમ બોલાવવાની સૂચનાની યાદી તપાસી શકે છે અને ઇ-મતદાન

સંબંધિત કોઈ પ્રશ્નો અથવા મુદ્દાઓની સ્થિતિમાં, સભ્યો વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQ") નો સંદર્ભ લઈ શકે છે અને વધુ વિગત માટે મદદ વિભાગ હેઠળ www.evotingindia.co.in પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અથવા helpdesk.evoting @cdslindia.com પર ઇમેઇલ મોકલીને મેળવી શકે છે. એજીએમના સમયે રિમોટ ઇ-વોટિંગ અથવા ઇ-વોટિંગ સાથે જોડાયેલ કોઈ ફરિયાદ હોય તેવા સભ્યો, સી.ડી.એસ.એલ.ના મેનેજર શ્રી રાકેશ દલવીનો સંપર્ક કરી વિંગ, ૨૫ મા માળ, મેરેથોન ફ્યુચર, મફ્તલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એન.એમ. માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઇ - ૪૦૦૦૧૩ અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨ પર સંપર્ક કરી શકો છો.

સભ્યો કે જેઓ ફીઝીકલ સ્વરૂપમાં શેર ધરાવે છે અથવા જેમના ઇમેઇલ સરનામાં કંપનીમાં નોંધાયેલા નથી તેઓ રિમોટ ઇ-વોટિંગ દ્વારા અથવા મીટિંગ સમયે ઇ-વોટિંગ દ્વારા જે રીતે બેઠક કરી શકે છે અને સૂચવેલા સૂચનોને અનુસરીને મત આપી શકે છે. કંપની ૩૫મી એજીએમ બોલાવે છે તે અંગેની નોટીસ અંગ્રેજી ભાષાના અખબાર બીઝનેસ સ્ટાન્ડર્ડમાં ૧૯ મી ઓગસ્ટ, ૨૦૨૦ના નોટિસના વિભાગમાં, અને ગુજરાતી ભાષાના અખબાર વેસ્ટર્ન ટાઇમ્સમાં તારીખ ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૦ને ગુરુવારે પ્રકાશિત થયેલી નકલનો સંદર્ભ લો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હુકમથી oલુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ભુમિત એમ. ધરોડ કંપની સેક્રેટરી

તારીખ : રજી સપ્ટેમ્બર, ૨૦૨૦

2020-21 **(1) કામનું નામઃ** અમદાવાદ ડિવિઝનમ ક્ષેસ્ટમ, ફ્રેર ડિસ્પ્લે બોર્ડસ, નેટવર્કિંગ સાથે CCTV વગે <mark>ખુલવાની તારીખ અને સમયઃ</mark> તા.30-09-2020 15:00 કલાક સુધી તે પછી નહીં અને તા.30-09 **ારનામુંઃ** ડિવિઝનલ રેલવે મેનેજર (એસ એન્ડ ટી તમરાવાદ. **ઈ-ટેન્ડરીંગની વેબસાઈટ**

Place: Ahmedabad

<u>ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ</u> ww.ireps.gov.in

પશ્ચિમ રેલવે – અમદાવાદ કિવિઝન

<u>ટેલીકોમ ઉપકરણોનું આપૂર્તિ,</u>

અમને ફ્રોલો કરોઃ 📂 twitter.com/WesternRly

જુદા-જુદા સ્ટેશનો ખાતે PRS/UTS/FOIS/ POET/NTES અને યાત્રી સુવિધાઓ જેવી કે PA વિવિધ ટેલીકોમ ઉપકરણોની આપૂર્તિ, ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ. (પુનઃઆમંત્રિત). **(2) કામની** અં**દાજત કિંમતઃ ₹** 31,23,700/- (રૂપિયા એકત્રીસ લાખ ત્રેવીસ હજાર સાત સો પૂરા) **(3) ઈએમડીઃ** ₹ 62,500/- **(4) ટેન્ડર બંધ થવાની અને ટેન્ડ**ર 2020 ના 15:30 કલાકે ટેન્ડર ખોલાશે. **(5) ઓફીસનું**

શ્રાંચ, નરોડા રોડ, પોસ્ટ-સૈજપુર બોઘા, અમદાવાદ-382 345. વેબસાઈટઃ <u>https://www.ireps.gov.in</u>

NOTICE TO THE SHAREHOLDERS Notice is hereby given that the 27th Annual General Meeting of

VINYOFLEX LIMITED

Regd. Off: 307, Silver Chamber, Tagore Road, Rajkot - 360 002.

CIN: L25200GJ1993PLC019830

Ph.: 0281-2468345, 2468776 Fax: 0281-2468839

Web site: www.vinvoflex.com · E mail: info@vinvoflex.com

VINYOFLEX LIMITED will be held on Monday 28th September, 2020 at 11.00 A. M. IST through video Conferencing ("VC") / other Audio Visual Means ("OAVM") to transact the Businesses, As Set Out In The Notice Dated 27th August 2020 Convening The AGM. The Notice of AGM, Annual Report Has Been Sent in Electronic Mode / physically to all Members in the Permitted Mode. The Above Documents Are Also Available On The Company's Website www.vinvoflex.Com.

2. Notice Is Also Hereby Given Pursuant To The Provision Of Section Of 91 Of The Companies Act, 2013 ("Act") And The Applicable Rules Framed There Under That The Register Of Men bers And Share Transfer Rooks Of T Company Will Remain Closed The Register of Members and Share Transfer Book from 18th September 2020 to 28th September 2020 (Both days inclusive) For The Purpose Of AGM. Furhter company has fixed 22nd September 2020 as a cut off date (Record Date) for the purpose of AGM.

3. Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 the Company is pleased to provide members facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means and the business may be transacted through e-Voting Services provided by Nationa Securities Depository Limited (NSDL).

The e-voting period commences as on Thursday 24th September, 2020 (9 a.m.) and ends on Sunday 27th September, 2020 (5 p.m.).

During this period shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) of 22nd September, 2020, may cast their vote electronically. The e-voting module shall also be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the shareholder, the shareholder shall not be allowed to change it subsequently.

The voting rights of Shareholders shall be in proportion to their shares of the paid up equity share capital of the Company. The detail instruction for attending AGM through VC/OAVM is provided in the notice. The said notice is also available on website of stock exchanges

www.bseindia.com and on company's website www.vinyoflex.com. by Order & behalf of the Board of Directors Date: 03-09-2020 for Vinvoflex Ltd Place: Rajkot

> CS. Hetal Lodhiva **Company Secretary** M.NO. A46684

GUJARAT CRAFT INDUSTRIES LIMITED

[CIN: L29199GJ1984PLC007130]

Regd. Office: 431, Santej-Vadsar Road, Santej - 382 721, Tal.: Kalol, Dist.: Gandhinagar (Gujarat) **EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS**

FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2020

(₹ in Lakh) Quarter Year **PARTICULARS** ended on 30-06-2019 30-06-2020 31-03-2020 3150.35 3285.51 14308.62 Total income from operations (Net) Net Profit / (Loss) for the period (before Tax, 233.10 54.29 279.62 Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 233.10 54.29 279.62 Net Profit / (Loss) for the period after tax 175.23 (after Exceptional and/or Extraordinary items) 38.67 214.66 Total Comprehensive Income for the period 175.50 39.36 215.73 488.83 488.83 488.83 **Equity Share Capital** Reserves (excluding Revaluation Reserves) 1,800.45 Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic: 3.59 0.81 4.39 Diluted: 3.59 4.39 NOTE

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.

The full format of Quarterly Financial Results are available on the website of BSE Limited at For GUJARAT CRAFT INDUSTRIES LIMITED

MANAGING DIRECTOR Date: 2nd September, 2020

ASHOK CHHAJER (DIN:00280185)